

રાઈટ ટુ રિકોલ પીએમ, સીએમ પક્ષ

(Right to Recall PM, CM, judges Party, રજિસ્ટ્રેશન બાકી છે)

ભારતની પ્રથમ અને એકમાત્ર પાર્ટી, જેમાં ડોનેશન પર પ્રતિબંધ છે ગાંધીનગર, અમદાવાદ(પુર્વ)ના અપક્ષ ઉમેદવાર રાહુલ ચીમનભાઈ મહેતા

40 yrs. B Tech, IIT Delhi, Computer Science ; MS Rutgers Univ, USA
(ગુજરાત, ભારતની અન્ય સીટો પર ઉમેદવારોની જાહેરાત ૬-એપ્રિલે થશે)

પક્ષના હેતુઓ: ૧. **MRCM** : ખનીજોની રોચાલ્ટી અને સરકારી જમીનનુ ભાડુ (દા.ત. મેનેજમેન્ટ વસ્ત્રાપુર પ્લોટનુ ભાડુ, નેહરુ યુનિવર્સિટી પ્લોટનુ ભાડુ, એરપોર્ટોના પ્લોટોનુ ભાડુ) સીધુજ નાગરીકો અને સેનાને આપવુ. દરેક નાગરીકને માસિક આશરે રૂ ૪૦૦ ની આવક થશે, ગરીબી ઘટશે અને સૈન્ય શક્તિ વધશે

૨. **રાઈટ ટુ રિકોલ** : પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, તમામ ન્યાયાધીશો, પોલીસ ચીફ, શિક્ષણ અધિકારી, રિઝર્વ બેંક ગવર્નરને નાગરીકો સીધાજ બદલી શકે (વર્ષો રાહ જોયા વિના), તેવા કાયદાઓ બનાવા- જેથી સરકારમાં, કોર્ટોમા ભ્રષ્ટાચાર ઘટે. નાગરીકો અધિકારીની બદલી અટકાવી શકે, તેવા કાયદાઓ પણ બનાવવા, જેથી અધિકારી દબાણ વિના કામ કરી શકે.

૩. નાગરીકોને રાશન કાર્ડની દુકાન અને ગેસ એજન્સી બદલવાની છુટ આપવી, જેથી દુકાનદારોની ચોરી ઘટે.

૪. જજ-પ્રથા નાબુદ કરી જ્યુરી-પ્રથા લાવવી, જેથી સગાવાદ ઘટે

૫. સરકાર, અદાલતોમાં ભર્તી માત્ર લેખિત પરીક્ષાઓથી કરવી અને ઇન્ટરવ્યુ પ્રથા રદ કરવી, જેથી સગાવાદ ભ્રષ્ટાચાર ઘટે

૬. નાગરીકોની ફરીયાદો અને નાગરીકે આપેલી ભ્રષ્ટાચારની માહિતી પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીના વેબસાઇટ પર મુકવી.

૭. ભારતનાં તમામ નાગરીકોને કાયદાઓ, ફરિયાદો, સુચનો પર તલાટીની કચેરીએ હા-ના નોંધાવવાની તક આપવી. નાગરીકોની હા-ના પણ પ્રધાનમંત્રીના વેબસાઇટ પર મુકવી

૮. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને નાગરીકો સીધા નિમી અને બદલી શકે તેવી પ્રોસીજરો બનાવવી, જેથી સાંસદોની કમાણી ઘટે

અન્ય ૭૦ કાયદાઓના લખાણ, વિગતો rahulmehta.com પર છે

રાઈટ ટુ રિકોલની એટલે શુ? રાઈટ ટુ રિકોલ એટલે કે નાગરીકો મંત્રી, અધિકારી, ન્યાયાધીશને રાહ જોયા વિના વચટીયાઓ વગર જાતેજ બદલી શકે. આ વ્યવસ્થા અમેરીકામાં સ્થાનિક, રાજ્ય સ્તરે ૧૮૦૦ માં થઈ. આજે અમેરીકાની પોલીસમાં ભ્રષ્ટાચાર નહીંવત છે, તો તેનું એકમાત્ર કારણ છે કે ત્યાં નાગરીકો પાસે જિલ્લા પોલીસ ચીફ અને સરકારી વકીલ બદલવાની પ્રોસીજર છે. યુરોપમાં કાર્લ માર્ક્સ ૧૮૭૧માં આ માંગણી કરી હતી. ભારતમાં ૧૯૪૬માં એમ એન રોયે અને ૧૯૬૫-૭૭માં જયપ્રકાશ નારાયણે અનેક વખત રાઈટ ટુ રિકોલની માંગણી કરી હતી, પણ કાયદાનું લખાણ નહોતુ આપ્યુ. જનતા પાર્ટી (૧૯૭૭) ઘોષણાપત્ર દ્વારા વાજપાઈ, અડવાણી પ્રથમ વખત મંત્રી બનેલા, તેમાં પણ રિકોલનાં અમલની ખાત્રી હતી. પણ ૩૦ વર્ષોમાં તેમણે કોઈ અમલ ન કર્યો. ભારતની અનેક સમસ્યાઓનું મુળ રિકોલનો અભાવ છે. દાત (૧)૨૦૦૮માં છ મહીના જમ્મુ સળગ્યુ કેમકે મનમોહનસિંહે અમરનાથ મંદીરને આપેલ જમીન જુંટવી લીધી. મનમોહનસિંહે જમીન જુંટવાની મજાલ કેમ કરી? કેમકે ભારતનાં નાગરીકો પાસે પ્રધાનમંત્રીને કાઢી મુકવાની પ્રોસીજર નથી (૨)આશારામનાં આશ્રમના બે બાળકોની હત્યામાં પોલીસે કેમ ભીનું સંકેલ્યુ? કેમકે અમદાવાદનાં નાગરીકો પાસે પોલિસ કમિશનર બદલવાની કે તેની બદલી અટકાવાની સત્તા નથી (૩)શીલજમાં ૨૦૦૮માં પૈસાદાર કાર ચાલકે ૩ વ્યક્તિઓને મારી નાખેલ. પોલીસે કેમ ભીનું સંકેલ્યુ? કેમકે નાગરીકો પાસે પોલિસ કમિશનર બદલવાની પ્રોસીજર નથી (૪)વાજપાઈએ ૧૯૯૬માં અમદાવાદનું નામ કર્ણાવતી કેમ ન કર્યું? કેમકે અમદાવાદના નાગરીકો પાસે સાંસદ બદલવાની સત્તા ન હતી. ગરજ સરી કે પેરી. નાગરીકોની અનેક સમસ્યાઓનું મુળ છે - મંત્રી, અધિકારી, ન્યાયાધીશ બદલવાની સત્તાનો અભાવ. રાઈટ ટુ રિકોલ પક્ષ ભારતનો એકમાત્ર પક્ષ છે, જેણે નાગરીકો પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, પોલિસ ચીફ, સુપ્રિમ ન્યાયાધીશો, રિઝર્વ બેંક ગવર્નર બદલી શકે તેવી પ્રોસીજરોનો લખાણ આપ્યા છે. અમારી નાગરીકોને વિનંતી છે કે તેઓ ભાજપ, કોંગ્રેસ, સામ્યવાદી અને અન્ય તમામ ઉમેદવારો પાસે - નાગરીકો મંત્રીઓ, ન્યાયાધીશો બદલી શકે - તેવી પ્રોસીજરોનો લખાણ માંગે, વાંચે અને પછી નક્કી કરે કે કયા લખાણને પોતાનો મત આપવો. અને રિકોલના વિરોધીઓને મત ન આપવો - જય હિન્દ

મીટીંગો: રાઈટ ટુ રિકોલ, કાયદાઓના મફત શિક્ષણ માટે અમે મીટીંગો રાખ્યે છીએ, જેમાં પત્રકારો, અન્ય નાગરીકોને આમંત્રણ છે. સમય: રોજ ૧૦-૨, શનિ રવિ ૧૦-૬ સ્થળ: ૧૦૧, રાજકમલ-A, સત્તર તાલુકા, સાકાર-૩ સામે, ઇન્ડમટેક્, અમદાવાદ રિકોલના કાયદાઓના પ્રચાર માટે કર્મશીલોની જરૂર છે, સંપર્ક કરવો (પગાર શુન્ય). સંપર્ક: ૮૮૨૫૧-૨૭૭૮૦, ૨૭૫૪૦૦૮૩ ; MehtaRahulC@yahoo.com **Join** forum.rahulmehta.com ; orkut.com/community.aspx?cmm=21780619 વાંચકોને વિનંતી કે આ જાહેરખબરની ઝેરોક્ષ સફુને આપવી